

## જીવંત અંગદાનની બાબતમાં માનવ પેશી અધિકાર (Human Tissue Authority) ની ભૂમિકા

ઈંગ્લેન્ડ, વેલ્સ અને ઉત્તર આયરલેન્ડમાં અંગ દાન માટે માનવ પેશી અધિનિયમ 2004 (The Human Tissue Act 2004) (HT અધિનિયમ) કાયદાકીય માળખું પૂરું પાડે છે. સ્કોટલેન્ડમાં માનવપેશી (સ્કોટલેન્ડ) અધિનિયમ 2006 (Human Tissue (Scotland) Act 2006) દ્વારા માળખું પૂરું પાડવામાં આવે છે.

માનવ પેશી અધિકાર (Human Tissue Authority –HTA) એ HT અધિનિયમ વિશે સલાહ અને માર્ગદર્શન પૂરું પાડે છે. અમે સંસદ દ્વારા નક્કી કરાયેલા માપદંડોના આધારે દરેક કેસને આગળ વધારી શકાય કે નહીં તેના વિશે નિર્ણય લઈને યુકેના જીવિત લોકોમાંથી કરાતા અંગોના દાનનું નિયમન કરીએ છીએ.

અમારી ભલામણ છે કે તમે તમારા પ્રત્યારોપણ એકમ દ્વારા પૂરી પડાયેલી અન્ય માહિતીની સાથોસાથ આ પત્રિકા વાંચો. આ તમને એ જાણવામાં મદદ કરશે કે જીવિત દાતા અને અંગ પ્રાપ્તકર્તા એમ બન્ને માટે શું સંકળાયેલું છે.

### સ્વતંત્ર આકારણીકર્તા દ્વારા ઈન્ટરવ્યૂ

બધા દાતાઓ અને અંગોના પ્રાપ્તકર્તાઓએ HTA દ્વારા તાલીમબદ્ધ અને અધિકૃત સ્વતંત્ર આકારણીકર્તા (Independent Assessor - IA) ને મળવું જરૂરી છે. IA અમારા વતી દાતા અને પ્રાપ્તકર્તા બન્નેનો અલગથી તેમજ સાથે ઈન્ટરવ્યૂ લે છે અને તે પ્રક્રિયાના તબીબી ભાગો સાથે સંકળાયેલી આરોગ્ય સંભાળ ટીમોથી સ્વતંત્ર હોય છે.

ઈન્ટરવ્યૂઓ હેતુ એ વાતની ખાતરી કરવાનો છે કે દાતાઓને તેમની ઈચ્છાઓ

વિરુદ્ધ કંઈ કરવાની ફરજ પડતી નથી, કોઈ પુરસ્કારની માગણી કે રજૂઆત કરાઈ નથી અને સૂચિત નિર્ણય લેવાની ક્ષમતા દાતા ધરાવે છે.

જટિલતાના આધારે, મોટા ભાગના ઈન્ટરવ્યૂમાં 30 મિનિટથી એક કલાકનો સમય લાગે છે. દાતાઓ અને પ્રાપ્તકર્તાઓને તેમની ઓળખ અને તેમના સંબંધનો પુરાવો સાથે લાવવાનું કહેવામાં આવશે.

જો HT અધિનિયમની શરતો પૂરી ન થતી હોય તો બે જીવિત વ્યક્તિઓ વચ્ચે પ્રત્યારોપણની પ્રક્રિયા ચલાવી એ એક ફોજદારી ગુનો છે. આનો અર્થ એ થાય છે કે માન્ય સંમતિ અપાઈ હોવી જોઈએ. માનવ અંગોની ખરીદી કે વેચાણમાં સામેલ થવું પણ એક ગુનો છે. આ ગુનાઓ માટેનો દંડ ત્રણ વર્ષ સુધીની જેલની સજા, દંડ કે બન્ને હોય છે. બધા દાતાઓને એ વાતની પુષ્ટિ આપતો સહી કરેલો ઘોષણા પત્ર પૂરો પાડવાનું કહેવામાં આવશે કે અંગ દાન અને પ્રત્યારોપણ સાથે કોઈ પુરસ્કાર સંકળાયેલો નથી.

## માનવ પેશી અધિકાર (Human Tissue Authority)

### જીવંત અંગ દાનની બાબતમાં અમારી ભૂમિકા



## સ્વતંત્ર આકારણી પ્રક્રિયા

દાતાને તેમના તબીબી વ્યવસાયી દ્વારા તબીબી અને ચિકિત્સકીય દૃષ્ટિએ દાન કરવા માટે યોગ્ય ગણવામાં આવ્યા હોય ત્યારબાદ HTA ના ઈન્ટરવ્યૂઝ ચાલશે.

### જીવિત દાતાના સહયોજક (Living Donor

Coordinator - LDC) દાતા, પ્રાપ્તકર્તા અને IA ને

અનુકૂળ હોય તેવા સમયે ઈન્ટરવ્યૂ ગોઠવશે. LDC અનુવાદક અથવા કોઈ અન્ય ખાસ જરૂરિયાતોની પણ જો જરૂર પડે તો વ્યવસ્થા કરશે.

ઈન્ટરવ્યૂ પછી ઈન્ટરવ્યૂનો અહેવાલ HTA સમક્ષ રજૂ કરવા IA પાસે કામકાજના 10 દિવસ હોય છે. પ્રત્યારોપણ એકમ દ્વારા તેને મોકલાયેલા તમામ કેસો અંગે HTA એ નિર્ણય

લેવાનો હોય છે. કેટલાક કેસોની આકારણી HTA ના સ્ટાફ સભ્ય કરી શકે છે, જ્યારે અન્ય કેસોની આકારણી બોર્ડના ત્રણ સભ્યોની પેનલ દ્વારા કરાય છે. HTA તેમને કેસો મોકલાયાના સમયથી કામકાજના પાંચ દિવસની અંદર તમામ નોન-પેનલ કેસોની અને કામકાજના દસ દિવસની અંદર તમામ પેનલકેસોની આકારણી કરવાનું લક્ષ્ય રાખે છે. સમયરેખા એ બિંદુ પરથી શરૂ થાય છે કે જ્યારે HTA પાસે કેસની આકારણી કરવા માટે જરૂરી હોય તેવી તમામ માહિતી હોય છે.

દરેક કેસ વિશે નિર્ણય લીધા પછી LDC અને દાતાની જવાબદારી ધરાવતા તબીબી વ્યવસાયીને જાણ કરવામાં આવશે. HTA વતી LDC દાતા અને પ્રાપ્તકર્તાને નિર્ણય જણાવે છે.



## સંપર્ક

આ પત્રિકા માત્ર એક માર્ગદર્શિકા છે. વધુ માહિતી માટે કૃપા કરી સંપર્ક કરો:

020 7269 1900

enquiries@hta.gov.uk

www.hta.gov.uk

@HTA\_UK

/HumanTissueAuthority

Human Tissue Authority  
151 Buckingham Palace  
Road London  
SW1W 9SZ

આ પત્રિકા અમારી વેબસાઈટ પર અરેબિક, બંગાળી, ગ્રીક, ગુજરાતી, હિંદી, પોલિશ, પંજાબી, ઉર્દૂ અને વેલ્શમાં ઉપલબ્ધ છે.

જુલાઈ 2014માં પ્રકાશિત

કૉપીરાઈટ: Human Tissue Authority